

The Divine is with you ...

The Divine is with you according to your aspiration. Naturally that does not mean that He bends to the caprices of your outer nature, – I speak here of the truth of your being. ... The attitude is very important, even the outer attitude. People do not know how important is faith, how faith is miracle, creator of miracles. If you expect at every moment to be lifted up and pulled towards the Divine, He will come to lift you and He will be there, quite close, closer, ever closer.

From SADHNA P.44
Comp. by Vijay


– The Mother

પ્રભુ તમારી સાથે છે ...

પ્રભુ તમારી સાથે છે, તમારી અભીપ્સા પ્રમાણે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ તમારી બાહ્યપ્રકૃતિના તરંગો અનુસાર ઝૂકતા રહે છે – અહીં હું તમારા આંતરિક સ્વરૂપના સત્ય વિષે વાત કરું છું. ... તમારું વલણ ઘણો અગત્યનો ભાગ ભજવે છે, તદ્દન બાહ્ય વલણ પણ. લોકો જાણતાં નથી કે શ્રદ્ધા કેટલી અગત્યની છે, શ્રદ્ધા કેવો ચમત્કાર છે, ચમત્કારોની પણ સર્જક છે શ્રદ્ધા. જો તમે એવી અપેક્ષા રાખતા હોવ કે દરેક ક્ષણે તમને ઉપર ઉઠાવી લેવામાં અને પ્રભુ તરફ ખેંચી લેવામાં આવે તો ખરે જ, તેઓ તમને ઉપર ઉઠાવી લેવા માટે આવશે અને તેઓ ત્યાં જ હશે, તમારી નજીક, તદ્દન નિકટ, હમેશાં તમારા સાંમિપ્યમાં.

– શ્રી માતાજી

©SRI AUROBINDO ASHRAM TRUST, PONDICHERRY.
FROM: SRI AUROBINDO KENDRA,
MATRUBHAVAN'87, SWASTIK SOCIETY, AHMEDABAD-9
<https://themothersprosperity.org>



Prosperity

શ્રી માતાજીની
સિદ્ધિ-રિદ્ધિ

2026

JANUARY

૧ જાન્યુઆરી, ૨૦૨૬

2026

Bonne Année

Blessings



It is the lesson of life that always in this world everything fails a man – only the Divine does not fail him, if he turns entirely to the Divine.

21.4.33

– Sri Aurobindo

જીવનનો બોધપાઠ છે કે આ જગતમાં દરેક વસ્તુ માનવીને હમેશ નિરાશ કરે છે – માત્ર પ્રભુ જ માનવને નિરાશ કરતા નથી, જો માનવ સમગ્રપણે પ્રભુ પ્રત્યે અભિમુખ થાય તો.

– શ્રી અરવિન્દ

“Why am I here?”

One has a big responsibility, it is to fulfil a special mission that one is born upon earth. ... The more conscious and individualised one becomes, the more should one have the sense of responsibility. But this is what happens at a given moment; one begins to think that one is here not without reason, without purpose. One realises suddenly that one is here because there is something to be done and this something is not anything egoistic. This seems to me the most logical way of entering upon the path – all of a sudden to realise, “Since I am here, it means that I have a mission to fulfil. Since I have been endowed with consciousness, it is that I have something to do with that consciousness – what is it?”

Generally, it seems to me that this is the first question one should put to oneself: “Why am I here?”

I have seen this in children, even in children of five or six: “Why am I here, why do I live?” and then to search, with whatever consciousness is available, with a very little bit of consciousness: why am I here, for what reason?

This seems to me the normal starting-point.

– The Mother

“હું અહીં શા માટે છું?”

આપણા દરેક ઉપર એક ઘણી મોટી જવાબદારી છે, તે છે આપણે જે ઉદ્દેશથી પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે તેને પરિપૂર્ણ કરવો. ... વ્યક્તિ જ્યારે વધુ સચેતન અને વધુ સ્વલક્ષી બને છે ત્યારે વ્યક્તિએ પોતાની જવાબદારી માટે પણ વધુ સમાન બનવું જોઈએ. પરંતુ બનતું હોય છે એવું કે કોઈ એક ક્ષણે વ્યક્તિ વિચારવાની શરૂઆત કરે છે, કે તે અહીં કોઈ કારણ કે હેતુ વગર અસ્તિત્વ ધરાવતી નથી. અચાનક તેને સમજાય છે કે તે અહીં છે કારણકે તેને કાંઈક કરવાનું છે, અને આ ‘કાંઈક’ કાંઈ અહંપ્રેરિત હોતું નથી. મને લાગે છે કે માર્ગ ઉપર પ્રવેશ માટેની આ સૌથી વધુ તાર્કિક પદ્ધતિ છે. – અચાનક સમજણનો ઝબકારો થવો કે “હું અહીં છું એનો અર્થ એ છે કે મારે કોઈ ઉદ્દેશ પૂર્ણ કરવાનો છે, કારણકે મને સચેતતા આપવામાં આવી છે, અને તેના વડે મારે કાંઈક કરવાનું છે – તે શું છે ?”

સામાન્યપણે મને લાગે છે કે આ સૌથી પહેલો પ્રશ્ન છે જેને સૌ કોઈએ પોતાની જાતને પૂછવો જોઈએ: “હું અહીં (પૃથ્વી ઉપર) શા માટે છું ?”

આ પ્રકારની જિજ્ઞાસા મેં બાળકોમાં જોઈ છે, પાંચ કે છ વર્ષના બાળકોમાં પણ: “હું અહીં શા માટે છું ?, હું શા માટે જીવું છું ?” અને ત્યાર પછી શોધવું. ચેતનાની જે અવસ્થા હોય, જે અલ્પમાત્રામાં સચેતનતા હોય તે વડે શોધવું: હું અહીં શા માટે છું, ક્યાં કારણ માટે ?

મને લાગે છે કે આ એક સામાન્ય પ્રારંભ બિન્દુ છે.

– શ્રી માતાજી